

મત્સ્યોદ્યોગ વિભાગની છેલ્લા ૧૦ વર્ષની નોંધપાત્ર સિધ્ધિઓ

- ગુજરાત રાજ્યનું દરીયાઈ મત્સ્ય ઉત્પાદન જે વર્ષ ૨૦૦૫-૦૬ માં ૬.૬૪ લાખ મે.ટન હતુ તે ૨૦૧૬-૧૭માં વધીને ૬.૯૯ લાખ મે.ટન અને આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન ૦.૯૦ લાખ મે. ટનમાંથી વધીને ૧.૧૭ લાખ ટન થયેલ છે. દરીયાઈ મત્સ્ય ઉત્પાદન માં રાજ્ય ધ્વારા મત્સ્ય ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી દેશમાં મોખરાનું સ્થાન હાંસલ કરેલ છે.
- ગુજરાત રાજ્યની મત્સ્ય પેદાશોની પરદેશ નિકાશ ૨૦૦૫-૦૬ માં ૧.૩૬ લાખ મે.ટન હતી જે ૨૦૧૬-૧૭ માં વધીને ૨.૩૭ લાખ મે.ટન અને તેનું વિદેશી હુંડીયામણ ૯૩૪.૮૮ કરોડથી વધીને ૪૪૧૨.૧૪ કરોડ થયેલ છે.
- રાજ્યમાં વર્ષ ૨૦૦૫-૦૬માં થયેલ ૬૧.૭૮ કરોડનું મત્સ્યબીજ ઉત્પાદન થયેલ તે વધીને વર્ષ ૨૦૧૫-૧૬ માં ૮૨.૮૦ કરોડનું ઉત્પાદન કરી રાજ્યએ સ્વનિર્ભરતા હાંસલ કરેલ છે.
- ખારલેન્ડ ની બીન ઉપયોગી જમીનને ઝીંગા ઉછેર હેઠળ આવરી લઈ અત્યાર સુધીમાં ૯૩૬૫ હેક્ટરનું માસ્ટર મેંપીંગ કરાવી ૫૭૫૭.૬૫ હેક્ટર જમીનની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવેલ છે. ૨૭૦૫૮ મે. ટન ઉત્પાદન મેળવી ૧૦૦૦૦ માણસોને સીધી રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
- દરીયામાં બોટોની અવર જવર માટે બોટ મુવમેન્ટ ની ટોકન પધ્ધતિ વર્ષ ૨૦૦૯-૧૦ થી ચાલુ છે. જે દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ છે.
- સને ૨૦૦૨-૦૩ થી માછીમારોને આધુનિક સાધનો ઉપર સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવતા જી.પી.એસ., ફીશ ફાઇન્ડર, વી.એચ.એફ. રેડીયો તથા લાઇફ સેવીંગ જેકેટ મળી કુલ ૪૯૦૮૦ સાધનો ની ખરીદી ઉપર રૂ.૨૦૩૮.૬૬ લાખની સહાય ચુકવવામાં આવેલ છે.
- ડીઝલ વેટ રાહતની યોજના તત્કાલીન માનનીય મુખ્ય મંત્રીશ્રી ધ્વારા તા.૧૩/૦૮/૨૦૧૨ ના વેરાવળ ખાતે સાગર ખેડુ સંમેલનમાં જાહેર કરવામાં આવતા આ યોજના ઓક્ટોબર -૨૦૧૨ થી મંજુર કરવામાં આવેલ છે. આ યોજના તળે વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ૪૦૭૨૮ માછીમાર લાભાર્થીઓને રૂ.૩૭૩૬.૯૯ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન ૫૨૭૮૨ માછીમાર લાભાર્થીઓને રૂ. ૮૯૯૯.૮૭ લાખની ડીઝલ વેટ રાહતની સહાય ચુકવવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૪-૧૫ માટે આ યોજના તળે ડીસેમ્બર -૧૪ સુધી રૂ.૬૨૪૪.૨૩ લાખની વેટ રાહત ૨૧૭૮૨ માછીમાર લાભાર્થીઓને ચુકવવામાં આવેલ છે.
- માછીમાર જુથ અકસ્માત વીમા યોજના તળે અગાઉ ફક્ત સરકારી મંડળીના સભ્યોને આવરી લઈ ૫૦૦૦૦/- વીમા કવચનો લાભ આપવામાં આવતો હતો જે વર્ષ ૨૦૧૪-૧૫ થી રાજ્યના તમામ ૨,૧૮,૨૭૦ સક્રીય માછીમારોને આ યોજના નીચે આવરી લઈ દરેક માછીમારને ૨,૦૦,૦૦૦/- ના વીમો કવચનો લાભ આપવામાં આવે છે.

- માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે બાયોમેટ્રીક્સ કાર્ડ બનાવવા માછીમારોના ડેટા કલેક્શનમાં દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્ય ધ્વારા સિધ્ધી હંસલા કરેલ છે. ૧,૨૭,૧૮૨ બાયોમેટ્રીક કાર્ડ માટેના વધુ ૧૧૧૭૪ ફોર્મ ભરાયેલ છે. જે ભારત છલે. સી. કંપનીને મોકલવામાં આવેલ છે.
- સને ૨૦૦૭-૦૮ થી અત્યાર સુધીમાં સાગર ખેડુ યોજના તળે રૂ.૪૮૦.૨૫ કરોડના ખર્ચે ૧,૭૨,૮૬૩ લાભાર્થીઓને મત્સ્યોઘોગની યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે.
- કચ્છ જિલ્લામાં જખૌ ખાતે ૧૦૦૦ બોટોની ક્ષમતા ધરાવતું મત્સ્યબંદર રૂ.૩૦.૩૧ કરોડના ખર્ચે વિકસાવાવમાં આવ્યું.
- નવસારી જિલ્લામાં ઘોલાઇ ખાતે ૪૦૦ બોટોની ક્ષમતા ધરાવાતા મત્સ્ય બંદરને રૂ.૧૪.૭૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું.